

B.A. Semester - 6 (CBCS) Examination
April/May-2022 (NEW COURSE)
PHI P22 YogaDarshan (Core -22 (New))

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧	યોગદર્શન અને સાંખ્ય વચ્ચેનો સંબંધ સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૧	ચિત્તનું સ્વરૂપ સમજાવી તેના પ્રકારો સમજાવો.	
પ્રશ્ન-૨	ચિત્તભુમી એટલે શું? તેના પ્રકારો સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૨	ચિત્તવૃત્તિના અવરોધો વર્ણવો.	
પ્રશ્ન-૩	ચિત્તવૃત્તિના નિરોધના ઉપાય તરીકે અભ્યાસ અને વૈરાગ્ય સમજાવો..	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૩	યોગના બહિરંગો સમજાવો.	
પ્રશ્ન-૪	સમાધિ અને તેના પ્રકારો સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૪	યોગમાં ઈશ્વરનું સ્થાન સમજાવો.	
પ્રશ્ન-૫	ટૂંકનોંધ લખો (કોઈ પણ બે)	(૧૪)
	૧. યોગની વર્તમાનમાં પ્રાસંગિકતા.	
	૨. કેવાલ્યનું સ્વરૂપ સમજાવો.	
	૩. પંચ કલેશ સમજાવો.	
	૪. ક્રિયાયોગ સમજાવો.	

ENGLISH VERSION

Que-1	Explain relation between yoga and sankhya.	(14)
	OR	
Que-1	Explain of nature of Chitta and its types.	
Que-2	What is Chittabhumi? Explain its types.	(14)
	OR	
Que-2	Describe the obstacles chittavrutti.	
Que-3	Explain the Abhyas and Vairagya as the remedy of Chittavrutti.	(14)
	OR	
Que-3	Explain the external organs of Yoga.	
Que-4	Explain the Samadhi and its types.	(14)
	OR	
Que-4	Explain the place of God in Yoga.	
Que-5	Write short answers: (any two)	(14)
	1. Importance of yoga in present era.	
	2. Explain the nature of Kaivalya.	
	3. Explain the five afflictions.	
	4. Explain the kriya yoga.	
